



સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

(રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર)

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મહેસાણા



સરદાર પટેલ રમત સંકુલ, પાંચોટ, રાધનપુર રોડ મુ.પો: પાંચોટ, તા.જિ: મહેસાણા

ફોન.નં- ૦૨૭૬૨-૨૯૯૦૫૫

EMAIL ID : dsdo-mehsana@gujarat.gov.in

જા.નં.ખે.મ.કુ.૨૦૨૫/જિ.ર.પ્ર.કે.મહે./૨૦૨૫-૨૬

તા.૨૩/૦૯/૨૦૨૫

પ્રતિ,

(૧) આચાર્યશ્રી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ.માધ્યમિક શાળાઓ, તમામ જિ. મહેસાણા

(૨) સી.આર.સી./બી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી, તમામ જિ. મહેસાણા

વિષય :- ખેલ મહાકુંભ-૨૦૨૫ શાળા/ગ્રામ્યકક્ષા રમત સ્પર્ધા કાર્યક્રમ બાબત

શ્રીમાન,

ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભનો હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રમાં આગળ આવી શાળા, ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો ઉમદા આશય છે.

ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધાકો ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં અલગ-અલગ વયજુથમાં સમાવેશ કરી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

ખેલ મહાકુંભ-૨૦૨૫ માં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ રમત સ્પર્ધાનું સૌ પ્રથમ શાળાકક્ષાએ તા.૨૪/૦૯/૨૦૨૫ થી તા.૨૬/૦૯/૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલ છે. જેથી ખેલ મહાકુંભ -૨૦૨૫ માં શાળાકક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ શાળા/ગ્રામ્યકક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. શાળા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાંથી ટીમ ઇવેન્ટમાંથી વિજેતા થયેલ ટીમ પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમજ વ્યક્તિગત રમતોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તાલુકાકક્ષાએ ભાગ લેવા જશે.

બિડાણ :-

- એસ.એ.જી.ગાંધીનગરનો ખેલ મહાકુંભ-૨૦૨૫નો પરિપત્ર, તા.૨૬/૦૯/૨૦૨૫ અને ઇવેન્ટ પત્રક

નોંધ :- ખેલ મહાકુંભ-૨૦૨૫ તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષા રમત સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમની જાણ હવે પછી કરવામાં આવશે.

વિરલ એ.ચૌધરી

જિલ્લા રમત ગમત અધિકારી
મહેસાણા

કિશોરબેન સાપરીયા

જિલ્લા રમત વિકાસ અધિકારી
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર
મહેસાણા

ડૉ.શરદ ત્રિવેદી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
મહેસાણા

બી.એન.પટેલ

જિલ્લા શિક્ષણાધિકારી
મહેસાણા

નકલ સવિનય રવાના જાણ સારૂ:

૧. માન.અગ્રસચિવશ્રી, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
૨. માન.ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર
૩. માન.સચિવશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
૪. માન.જિલ્લા કલેક્ટરશ્રી, કલેક્ટર કચેરી, મહેસાણા

૫. માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત,મહેસાણા.
૬. માન.જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી, મહેસાણા.
૭. માન.પ્રાંત અધિકારીશ્રી તમામ, જિ.મહેસાણા
૮. માન.નાયબ માહિતી નિયામકશ્રી, માહિતી ભવન,મહેસાણા
૯. માન.મામલતદારશ્રી, તમામ, જિ.મહેસાણા
૧૦. માન.પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કુકસ, જિ.મહેસાણા
૧૧. તાલુકા વિકાસ અધિકારીશ્રી, તમામ, જિ.મહેસાણા.
૧૨. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ, જિ. મહેસાણા
૧૩. પ્રમુખશ્રી/મંત્રીશ્રી, જિલ્લા વ્યાયામ મંડળ, મહેસાણા
૧૪. પ્રમુખ/મંત્રીશ્રી,એસોસીએશન તમામ રમતો,જિ.મહેસાણા

❖ આયોજન અને સંચાલન

ખેલ મહાકુંભનું સમગ્ર આયોજન-સંચાલન જેતે કક્ષાની અમલીકરણ સમિતિ દ્વારા કરવાનું રહેશે.

પ્રા.શાળા	ગ્રામ્ય	તાલુકા	જિલ્લા	મહાનગરપાલીકા	જિલ્લાકક્ષાની પસંદગી અને ટેકનિકલ
પ્રાથમિકશાળા નાઆચાર્ય અધ્યક્ષ	સરપંચ અધ્યક્ષ	પ્રાંત અધિકારી અધ્યક્ષ	કલેક્ટર અધ્યક્ષ	મ્યુનિ. કમિશનરશ્રી અધ્યક્ષશ્રી	જિલ્લા વિકાસ અધિકારીશ્રી અધ્યક્ષ
સી.આર.સી સભ્ય	માધ્યમિક શાળાના આચાર્ય સભ્ય	મામલતદાર કન્વીનર	જિલ્લા વિકાસ અધિકારી ઉપાધ્યક્ષ	ડે. મ્યુનિ. કમિશનરશ્રી (નિયુક્ત) સભ્યશ્રી	જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સભ્ય
વ્યાયામ શિક્ષક સભ્ય સચિવ	પ્રાથમિક શાળાના આચાર્ય સભ્ય સચિવ	તાલુકા વિકાસ અધિકારી સભ્ય	વાઈસ ચાન્સેલર યુનિવર્સિટી હોય તો સભ્ય	નાયબ પોલીસ કમિશનરશ્રી (નિયુક્ત) સભ્યશ્રી	જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એસ.એ.જી સભ્ય
	સ્વામી વિવેકાનંદ ગામ યુવક મંડળના પ્રમુખ સભ્ય	તાલુકા સ્વામી વિવેકાનંદ મંડળના પ્રમુખ સભ્ય	પોલીસ અધિક્ષક સભ્ય	મ્યુનિસિપલ કમિશનરશ્રી નિયુક્ત ૩ પ્રતિષ્ઠિત નાગરિકો (બે રમત વીરો) સભ્ય	જિલ્લા રમતગમત અધિકારીશ્રી સભ્ય સચિવ
	તલાટી કમ મંત્રી સભ્ય	બી.આર.સી. સભ્ય સચિવ	જિલ્લા શિક્ષણાધિકારી (પ્રાથમિક અને માધ્યમિક) સભ્ય	મહાનગર સ્વામી વિવેકાનંદ મંડળના પ્રમુખશ્રી સભ્યશ્રી	
		સી.આર.સી. સભ્ય	પ્રિન્સીપાલ, શિક્ષણ અને તાલીમ ભવન સભ્ય	મહાનગર નામાંકિત શાળા આચાર્ય સભ્યશ્રી	
			સ્વામી વિવેકાનંદ જિલ્લા યુવક મંડળના પ્રમુખ સભ્ય	જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એસ.એ.જી સભ્ય	
			જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એસ.એ.જી (સભ્ય)	જિલ્લા રમતગમત અધિકારી સભ્ય સચિવ	
			DIETના શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા સભ્ય		
			જિલ્લા રમત ગમત અધિકારી સભ્ય સચિવ		

ખેલ મહાકુંભ-૨૦૨૫ શાળા/ગ્રામ્યકક્ષાથી શરૂ થતી રમત સ્પર્ધા કાર્યક્રમ

તા. ૨૪/૦૯/૨૦૨૫ થી તા. ૨૬/૦૯/૨૦૨૫ સુધી

ક્રમ	વયજૂથ	રમતનું નામ	સ્પર્ધા તારીખ	સ્પર્ધા સ્થળ	સ્પર્ધા અધ્યક્ષશ્રી	સહય સચિવશ્રી/ કન્વીનરશ્રી
૧	અંડર-૯	૩૦ મી દોડ, સ્ટેન્ડીંગ બ્રોન્ડ જમ્પ	૨૪/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૨	અંડર-૧૧	૫૦ મી દોડ, સ્ટેન્ડીંગ બ્રોન્ડ જમ્પ	૨૪/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૩	અંડર-૧૪	એથલેટીકસ ૧૦૦ મી દોડ, લાંબીકુદ, ગોળાફેક	૨૪/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૪	અંડર-૧૭	એથલેટીકસ ૧૦૦ મી દોડ, લાંબીકુદ, ગોળાફેક, લંગડી ફાળ કુદ	૨૪/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૫	અંડર-૧૪	કબડ્ડી	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૬	અંડર-૧૭	કબડ્ડી	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૭	અંડર-૧૪	ખો-ખો	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૮	અંડર-૧૭	ખો-ખો	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૯	અંડર-૧૪	વોલીબોલ	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૧૦	અંડર-૧૭	વોલીબોલ	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૧૧	અંડર-૧૭	રસ્સાખેંચ	૨૫/૦૯/૨૦૨૫	જે તે શાળામાં	આચાર્યશ્રી	વ્યાયામ શિક્ષકશ્રી/ શિક્ષકશ્રી
૧૨	ઓપનએજ	એથલેટીકસ ૧૦૦ મી દોડ, લાંબીકુદ, ગોળાફેક, લંગડી ફાળ કુદ	૨૫/૦૯/૨૦૨૫	જે તે ગામની શાળામાં	સરપંચશ્રી	જે તે ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી
૧૩	ઓપનએજ	કબડ્ડી	૨૬/૦૯/૨૦૨૫			
૧૪	ઓપનએજ	ખો-ખો	૨૬/૦૯/૨૦૨૫			
૧૫	ઓપનએજ	વોલીબોલ	૨૬/૦૯/૨૦૨૫			
૧૬	ઓપનએજ	રસ્સાખેંચ	૨૬/૦૯/૨૦૨૫			
૧૭	૪૦ અને ૬૦ વર્ષ ઉપર	રસ્સાખેંચ	૨૬/૦૯/૨૦૨૫			

શાળા/ગ્રામ્યકક્ષાથી શરૂ થતી ઉપરોક્ત સ્પર્ધા કાર્યક્રમ મુજબ પોતાની શાળામાં આયોજન કરવાનું રહેશે અને ઉપરોક્ત સ્પર્ધામાંથી ટીમ ઇવેન્ટમાંથી વિજેતા થયેલ ટીમ ઇવેન્ટ તેમજ વ્યક્તિગત રમતોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તાલુકાકક્ષાએ ભાગ લેવા જશે.

સ્પર્ધા અંગેની સુચનાઓ :-


- ખેલ મહાકુંભમાં માત્ર જન્મ તારીખને ધ્યાનમાં રાખવાની રહેશે. અને કોઈ પણ રમતવીર સ્પર્ધામાં ભાગ લઈ શકશે તેમાં ધોરણને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં.
- ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધાઓમાં માત્ર જન્મ તારીખના આધારે કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
- શાળા/ગ્રામ્યકક્ષાએ થી તાલુકાકક્ષા, તાલુકાકક્ષાએ થી જિલ્લાકક્ષા અને જિલ્લાકક્ષાએ થી ઝોનકક્ષા/રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા વિજેતા ખેલાડીઓની એન્ટ્રી ઓનલાઈન મોકલી આપવાની રહેશે. ઓનલાઈન એન્ટ્રી વગર કોઈ પણ સ્પર્ધકને ઉપરની કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
- સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયજુથ પ્રમાણેની રમતો, વજન ગ્રુપ તેમજ ઇવેન્ટની માહિતી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ હોય તે મુજબ ખેલાડીએ ભાગ લેવાનો રહેશે.
- ખેલાડીથી શરત ચુકથી ખરેખર પોતાની વયજુથ કરતાં અન્ય વયજુથમાં રજિસ્ટ્રેશન થઈ ગયેલ હોય તો કટ ઓફ ડેટને ધ્યાને રાખી ખરેખર જે વયજુથમાં રમવા માટે લાયકાત ધરાવતા હોય તે વયજુથમાં ભાગ લઈ શકશે તેની ચકાસણી જિલ્લા રમત વિકાસ અધિકારી/ જિલ્લા રમત ગમત અધિકારીએ કરવાની રહેશે.
- જે તે કક્ષાની સ્પર્ધા શરૂ થાય તે પહેલા નાફુરસ્ત, અશક્ત વિદ્યાર્થીઓ તેમજ રમતવીરો સ્પર્ધામાં ભાગ ન લે તેની તકેદારી ટીમ મેનેજર અને કોચે રાખવાની રહેશે.
- શાળા/ગ્રામ્યમાંથી તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધામાં
 - વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.
 - ટીમ રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ટીમો ખેલાડીઓ ભાગ લેશે.
- શાળા/ગ્રામ્યકક્ષાએથી વિજેતા થઈ તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે.
- ખેલ મહાકુંભમાં યોજવામાં આવતી તમામ સ્પર્ધાઓ જે તે રમતના ભારતના માન્ય ફેડરેશન/એસોસિએશનના નીતિ નિયમો તેમજ ખેલ મહાકુંભના વખતો વખત થયેલા સુધારા સાથેના સામાન્ય નિયમો મુજબ યોજવાની રહેશે.
- જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
- રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.
- કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી એક અથવા બે જ રમતમાં ભાગ લઈ શકશે.
- દરેક સ્પર્ધા નિયત કાર્યક્રમ પ્રમાણે યોજવાની રહેશે.
- ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
- જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
- શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
- કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
- સ્પર્ધા દરમ્યાન કોઈ પણ પ્રકારનો વિવાદ કે વાંધો હોય તો ખેલાડીએ લેખિતમાં રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) ની પ્રોટેસ્ટ ફી સાથે અડધા કલાકની અંદર જિલ્લા આયોજન કમિટી સમક્ષ પ્રોટેસ્ટ રજુ કરવાનો રહેશે. જિલ્લા આયોજન કમિટિનો નિર્ણય આખરી અને સર્વેને માન્ય અને બંધન કર્તા રહેશે.

- ખેલ મહાકુંભની સ્પર્ધા સિવાયના કોઈપણ અકસ્માત કે અન્ય બાબતોથી ખેલાડીને ઈજા કે અન્ય ઘટનાથી ખેલાડીને શારીરિક કે માનસિક નુકસાન થાય તે માટે સરકારશ્રીની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.
- સ્પર્ધા સમયે ખેલાડીએ આધાર કાર્ડ, ચુટણી કાર્ડ, શાળાના બોનાફાઇડ અસલ સાથે લઇને આવવાનું રહેશે.
- સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે.



વિરલ એ. ગૌઘરી

જિલ્લા રમત ગમત અધિકારી
મહેસાણા




કિલ્લોલબેન સાપરીયા

જિલ્લા રમત વિકાસ અધિકારી
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર
મહેસાણા



ડી. શરદ ત્રિવેદી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
મહેસાણા



બી. એન. પટેલ

જિલ્લા શિક્ષણાધિકારી
મહેસાણા



ક્રમાંક:એસએજી/ખેમકું ૨૦૨૫/૨૦૨૫-૨૬
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
વહીવટી બિલ્ડીંગ,
સેક્ટર-૧૩, બી, ખ-૩ સર્કલ નજીક,
વાવોલ રેલ્વે કોસીંગ પાસે,
ગાંધીનગર. તા.૨૬/૦૮/૨૦૨૫

વિષય:- ખેલ મહાકુંભ-૨૦૨૫ રજિસ્ટ્રેશન

પરિપત્ર :-

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથલેટીક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.

(૧) રજિસ્ટ્રેશન:-

- ખેલ મહાકુંભ-૨૦૨૫નું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૫થી શરૂ કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ-૨૦૨૫ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૯/૨૦૨૫ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.
- ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ <https://khemmahakumbh.gujarat.gov.in> પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. એક જ KMK IDથી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે.
- જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જુના KMK IDથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે.
- કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
- અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

(૨) સ્પર્ધાઓ

૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	રમત
૧	૯ વર્ષથી નીચે	૩૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૨	૧૧ વર્ષથી નીચે	૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૩	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬	૪૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ
૭	૬૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ

૨. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	ચેસ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૫	૪૦ વર્ષથી ઉપર	ચેસ
૬	૬૦ વર્ષથી ઉપર	ચેસ

૩. જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
૨	૧૪ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૩	૧૭ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, રઝ્બી
૪	ઓપન એજ ગ્રુપ	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રઝ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૫	૪૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ
૬	૬૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ


૪. સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, સ્વીમીંગ, ટેકવોન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, જિમ્નાસ્ટીક્સ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
૫	૪૦ અને ૬૦ વર્ષથી ઉપર	યોગાસન

(3) સ્પર્ધાના સામાન્ય નિયમો :-

- સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે.
- જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઇડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
- રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.
- કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે.
- રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
- ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
- કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
- સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઈને આવવાની રહેશે.

ખેલ મહાકુંભ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફોલોઅપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.


સંદીપ સાગર (આઈ.એ.એસ)

ડાયરેક્ટર જનરલ

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

ગાંધીનગર

બિડાણ:-પત્રક- અ - રોકડ- પુરસ્કાર

નકલ સવિનય રવાના જાણ સારું

(૧) અંગત સચિવશ્રી,

માન.મંત્રીશ્રી, રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર, ગાંધીનગર

(૨) અંગત સચિવશ્રી,

માન. અગ્ર સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર

પ્રતિ,

(૧) કલેક્ટરશ્રી, તમામ

(૨) મ્યુ.કમિશનરશ્રી, તમામ

(૩) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ

(૪) વાઈસ ચાન્સેલરશ્રી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર

(૫) કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર

(૬) કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

(૭) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

(૮) નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ, ગાંધીનગર

(૯) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

(૧૦) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

(૧૧) પ્રિન્સીપાલશ્રી, જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન તમામ

(૧૨) શાસનાધિકારીશ્રી, મ્યુનિ.કોર્પોરેશન તમામ

(૧૩) પ્રમુખ/મંત્રીશ્રી, રાજ્યકક્ષાના માન્ય રમતગમત મંડળો

(૧૪) જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તમામ

(૧૫) જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, તમામ

(૧૬) શાખા અધિકારીશ્રી, એસ.એ.જી., તમામ

પત્રક-અ

ખેલ મહાકુંભ-૨૦૨૫					
તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર					
૧	ખેલાડીઓ	તાલુકાકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતીય	૧૦૦૦	૭૫૦
			તૃતીય	૭૫૦	૫૦૦
		જિલ્લાકક્ષા	પ્રથમ	૫૦૦૦	૩૦૦૦
			દ્વિતીય	૩૦૦૦	૨૦૦૦
			તૃતીય	૨૦૦૦	૧૦૦૦
		રાજ્યકક્ષા	પ્રથમ	૧૦૦૦૦	૫૦૦૦
			દ્વિતીય	૭૦૦૦	૩૦૦૦
			તૃતીય	૫૦૦૦	૨૦૦૦
શ્રેષ્ઠ શાળા					
૨	શાળા	તાલુકાકક્ષા	પ્રથમ	૨૫૦૦૦	-
			દ્વિતીય	૧૫૦૦૦	-
			તૃતીય	૧૦૦૦૦	-
૩	શાળા	જિલ્લાકક્ષા	પ્રથમ	૧૫૦૦૦૦	-
			દ્વિતીય	૧૦૦૦૦૦	-
			તૃતીય	૭૫૦૦૦	-
૪	શાળા	રાજ્યકક્ષા	પ્રથમ	૫૦૦૦૦૦	-
			દ્વિતીય	૩૦૦૦૦૦	-
			તૃતીય	૨૦૦૦૦૦	-

રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓના કોચને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ					
૧	કોચ	રાજ્યકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતીય	૧૨૦૦	૭૫૦
			તૃતીય	૯૦૦	૫૦૦

અંક ૯ (તા.૦૧/૦૧/૨૦૧૭ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
અંક ૧૧ (તા.૦૧/૦૧/૨૦૧૫ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
ચેસ	<input type="checkbox"/> ચેસ
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મીટર <input type="checkbox"/> લાંબી કુદ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
સ્વીમીંગ	વ્યક્તિગત મીડલે (૨૦૦ મીટર)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ ૧ (૧૫૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦મી) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૧૫૦૦મી)
અંક ૧૪ (તા.૦૧/૦૧/૨૦૧૨ અને તે પછી જન્મેલા)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦મીટર <input type="checkbox"/> લાંબીકુદ <input type="checkbox"/> ગોળા ફેંક
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૧ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૪૮ કિગ્રા)
સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦ મીટર <input type="checkbox"/> ૪૦૦ મીટર <input type="checkbox"/> ૬૦૦ મીટર <input type="checkbox"/> ઉચીકુદ <input type="checkbox"/> ચક્રફેંક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરબોલ)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફલાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
આર્થિસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફ્રીગર <input type="checkbox"/> ક્વોટ્ટેટ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૫ કિગ્રાથી ઉપર અને -૩૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૦ કિગ્રાથી ઉપર અને -૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી
	બહેનો <input type="checkbox"/> ૨૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૩ કિગ્રાથી ઉપર અને -૨૭ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૭ કિગ્રાથી ઉપર અને -૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨ કિગ્રાથી ઉપર અને -૩૬ કિગ્રા સુધી
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૩ કિગ્રા <input type="checkbox"/> ૩૩-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૯ કિગ્રા <input type="checkbox"/> ૩૯-૪૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૧ કિગ્રા <input type="checkbox"/> ૨૩-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૪૧ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૩૮ કિગ્રાથી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
ફુટબોલ	<input type="checkbox"/> ફુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૨૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર

નોંધ:- યોગાસન માટે,
 > ગ્રુપ-A-પશ્ચિમોત્તાસન, સર્વોગાસન, મત્સ્યાસન, અર્ધમત્સ્યાસન, પુર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન
 > ગ્રુપ-B- પુર્ણ ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપુર્ણ, સલભાસન, બકાસન, શિર્ષાસન
 > ગ્રુપ-C- સાંખ્યાસન, વ્યાધ્રાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિશતિતિવાસન, પદ્મ મથુરાસન, ઉત્તિશ્યાપાદસ્તાસન
 > રાજ્યકક્ષાએ બેસ્ટ એક ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
 > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
 > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
 > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટિક્સ	<input type="checkbox"/> ૮૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ રીલે ૪x૧૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલ રીલે ૪x૧૦૦મી
	<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રાથી ઉપર અને -૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૩૬ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૫ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૧-૨૩ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૨૭ કિગ્રા <input type="checkbox"/> ૨૯-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૧૬-૧૮ કિગ્રા <input type="checkbox"/> ૨૦-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૯-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરિંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> હોરિઝોન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ ૧ (૨૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૨૦૦૦ મી.)
આર્ચરી	રીફલ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
શુટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્તોલ <input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઇટ એર રાયફલ
ટેન્સીંગ	<input type="checkbox"/> ક્લોથ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૨૮-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા
મલખંલ	<input type="checkbox"/> રોપ મલખંલ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલખંલ (ફક્ત ભાઈઓ માટે)
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકરાવ	<input type="checkbox"/> રેગુ <input type="checkbox"/> કવોડસ
સ્પોર્ટ્સ ક્લામીંગ	<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

> શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
> શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલ મહાકુંભ-૨૦૨૫

અંક ૧૭ (તા.૦૧/૦૧/૨૦૦૯ અને તે પછી જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

❖ સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટિક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીકૂદ <input type="checkbox"/> લંગડીફાઇ કૂદ <input type="checkbox"/> ગોળાકેંક
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૪૮૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૦૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૫૫ કિગ્રા)

❖ સીધી તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટિક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ઉચ્ચકૂદ <input type="checkbox"/> બરછીકેંક <input type="checkbox"/> ચક્રકેંક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)

નોંધ:-યોગાસન માટે.
> ગ્રુપ-નપચિમોતાસન,સર્વોગાસન,મત્સ્યાસન,અર્ધમ.તોન્ડ્રાસન,પુર્ણ ધનુરાસન, ઉતાન પાદાસન
> ગ્રુપ-ક પુર્ણ ચક્રાસન, કુકુડાસન, ભુમાસનપુર્ણ, સલભાસન, બકાસન,શિર્ષાસન
> ગ્રુપ- C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુડાસન, ઉત્તિશ્ચિતિવાસન, પદ્મ મયુરાસન,ઉત્તિશ્ચાહસ્તાસન
> રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા

સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૨૦૦ મી.
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨(૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીક ૩(૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪(૧૦૦૦ મી.)

જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રાથી ઉપર અને -૫૦ કિગ્રા સુધી
	બહેનો <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર અને -૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રાથી ઉપર અને -૬૦ કિગ્રા સુધી

કુસ્તી	ભાઈઓ-ફ્રીસ્ટાઇલ <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા
	બહેનો-ફ્રીસ્ટાઇલ <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૩ કિગ્રા <input type="checkbox"/> ૪૩-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૩ કિગ્રા

ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫ -૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૮ કિગ્રા થી ઉપર

બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર
રગ્બી	<input type="checkbox"/> રગ્બી

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
> યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
> બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
> યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
> બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
> એથલેટિક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
> સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલેમાં ભાગ લઈ શકશે.
> જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
> કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કારાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૧૦૦ મી હર્ટલ્સ (બહેનો) <input type="checkbox"/> ૧૧૦ મી હર્ટલ્સ (ભાઈઓ) <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે <input type="checkbox"/> વાંસફ <input type="checkbox"/> હથોડા ફેક <input type="checkbox"/> ૫ કી.મી.વોક(ભાઈઓ) <input type="checkbox"/> ૩ કી.મી.વોક(બહેનો) <input type="checkbox"/> ૪૦૦ મી હર્ટલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૮૦૦મી(ભાઈઓ) <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૪૦૦ મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ રીલે ૪ x ૧૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> મીડલ રીલે ૪ x ૧૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર અને -૬૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૬ કિગ્રાથી ઉપર અને -૭૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૩ કિગ્રાથી ઉપર અને -૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧ કિગ્રાથી ઉપર અને -૯૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૯૦ કિગ્રાથી ઉપર બહેનો <input type="checkbox"/> ૫૨ કિગ્રાથી ઉપર અને -૫૭ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૭ કિગ્રાથી ઉપર અને -૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩ કિગ્રાથી ઉપર અને -૭૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૦ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ (ફ્રીસ્ટાઇલ) <input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૧૧૦ કિગ્રા બહેનો (ફ્રીસ્ટાઇલ) <input type="checkbox"/> ૫૩- ૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલબાર <input type="checkbox"/> પોમલોસ <input type="checkbox"/> હોરિજોનલબાર બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> વેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.) ઈનલાઈન <input type="checkbox"/> રોડ રેસ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
શુટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્ટોલ <input type="checkbox"/> ૧૦ મી.પીપ સાઈટ એર રાયફલ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઈટ એર રાયફલ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૯ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા થી ઉપર બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા થી ઉપર
ફેન્સીંગ	<input type="checkbox"/> ફોઇલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ કિગ્રાથી ઉપર <input type="checkbox"/> ૪૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ થી ઉપર
મલાખલ	<input type="checkbox"/> શેપ મલાખલ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલાખલ (ફક્ત ભાઈઓ માટે)
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકરાવ	<input type="checkbox"/> રેગુ <input type="checkbox"/> કવોડસ
સ્પોર્ટ્સ ક્લબીંગ	<input type="checkbox"/> લીડ ક્લબીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લબીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ
ફેરપ્લે	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> ટીમ
વુડબોલ	સ્કોક <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> ટીમ

જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
જીમ્નાસ્ટીક સ્પર્ધામાના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની સાઈફલ લાવવાની રહેશે.
ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
શુટીંગ સ્પર્ધામાં એર પીસ્ટોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલ મહાકુંભ-૨૦૨૫

ઓપન એઈજ ગ્રુપ (તા.૦૧/૦૧/૧૯૨૬ અને તે પછી જન્મેલા)	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીફૂટ <input type="checkbox"/> લંડાકીફાળ ફૂટ <input type="checkbox"/> ગોળાફેક
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૪૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૫કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૫કિગ્રા)
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
❖ સીધી તાલુકા / ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ઉર્ચીકુદ <input type="checkbox"/> બરછીફેક <input type="checkbox"/> ચક્રફેક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
શુટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા (નોંધ:- યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.)
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૨૦૦ મી.
આર્ટીસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફીગર
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.) ઈન લાઈન <input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રાથી ઉપર અને -૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર અને -૬૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૬ કિગ્રાથી ઉપર અને -૭૩ કિગ્રા સુધી બહેનો <input type="checkbox"/> ૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪ કિગ્રાથી ઉપર અને -૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૮ કિગ્રાથી ઉપર અને -૫૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૨ કિગ્રાથી ઉપર અને -૫૭ કિગ્રા સુધી
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૩ કિગ્રા <input type="checkbox"/> ૫૩-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૩ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરઓલ)

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોરમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

કરાટે	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૭૪-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮-૮૨ કિગ્રા <input type="checkbox"/> ૮૨ કિગ્રાથી ઉપર
૨૩મી	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર
૨૩મી		
❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖		
એથલેટીક્સ		<input type="checkbox"/> ૫૦૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ x ૪૦૦ મી. રીલે <input type="checkbox"/> વાંસફા <input type="checkbox"/> હથોડા ફેંક
સ્વીમીંગ		<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ રીલે ૪ x ૧૦૦મી.
		<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી
		<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૭૩ કિગ્રાથી ઉપર અને -૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧ કિગ્રાથી ઉપર અને -૯૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૯૦ કિગ્રાથી ઉપર અને -૧૦૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૫૭ કિગ્રાથી ઉપર અને -૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩ કિગ્રાથી ઉપર અને -૭૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૦ કિગ્રાથી ઉપર અને -૭૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ	<input type="checkbox"/> ૭૪-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા
આર્ચરી		<input type="checkbox"/> રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
		<input type="checkbox"/> કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ	<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> શેમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> શેરિજોટલબાર
	બહેનો	<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	ક્રોલ	<input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન	<input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
સાઈકલિંગ		
શુટીંગ	રાઈફલ ગ્રુપ	<input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઈફલ ૩ પોજિશન
	પિસ્તોલ ગ્રુપ	<input type="checkbox"/> ૧૦ મી. એર પિસ્તોલ <input type="checkbox"/> ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ	<input type="checkbox"/> શોટગન ટ્રેપ <input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા <input type="checkbox"/> ૧૧૬ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૪ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા <input type="checkbox"/> ૯૩ કિગ્રા થી ઉપર
ક્રેન્સીંગ		<input type="checkbox"/> ક્લોથ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩.૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩.૫-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૬૭-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા
બીચ હેન્ડબોલ		<input type="checkbox"/> બીચ હેન્ડબોલ
બીચ વોલીબોલ		<input type="checkbox"/> બીચ વોલીબોલ
થ્રોડેસવારી		<input type="checkbox"/> જમીંગ (ભાઈઓ) <input type="checkbox"/> એન્થ્રોપ્સ(ભાઈઓ)
મલાખંસ		<input type="checkbox"/> રોપ મલાખંસ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલાખંસ (ફક્ત ભાઈઓ માટે)
સોકર ટેનીસ		<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ
સ્પોર્ટ્સ ક્લામીંગ		<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ
વુડબોલ	ફેરપલે	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ
	સ્ટ્રોક	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ

➤ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે

➤ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે.

➤ બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)ના નિયમો મુજબ યોજાશે

➤ શુટીંગ સ્પર્ધામાં રાઈફલ અથવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઈપણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે

બેલ મહાકુંભ-૨૦૨૫

૪૦ વર્ષથી ઉપર (તા.૦૧/૦૧/૧૯૬૬ થી તા.૩૧/૧૨/૧૯૮૫ દરમ્યાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

❖ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

રસ્સાખેંચ ભાઈઓ ૫૬૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

❖ સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

ચેસ ચેસ

નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

શુટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક
સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.	

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૪૦ માં માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

➤ આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉત્થિતપાદઆસન, કુર્મોસન, યોગાસન

➤ પાછળ જુકવાનું આસન:- ચકાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, ભુજાસન, સેતુબંધારાસન

➤ કમળને વળાંક આપનું આસન:-પૂર્ણમત્તેન્દ્રઆસન, કમરમરોડાસન, વકાસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

❏ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏	
યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

50 વર્ષથી ઉપર (તા.૩૧/૧૨/૧૯૬૫ અને તે પહેલા જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે	<input checked="" type="checkbox"/>	કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)
------------------------------------	-------------------------------------	---------------------------------

❏ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❏

રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૬૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
-----------	--

❏ સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❏

ચેસ	<input type="checkbox"/> ચેસ
-----	------------------------------

❏ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏

બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	નોંધ: યોગાસન માટે (રાજ્યકક્ષા) અબોવ-૬૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે. આગળ જુકવાનું આસન, પાછળ જુકવાનું આસન, કમળને વળાંક આપતું આસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી. ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક	સ્વીમીંગ રમતમાં કોઇપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
	<input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી. બટર ફ્લાય સ્ટ્રોક	

❏ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏

યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ
--------	--